

## આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ભાગ રૂપે તા ૬ અને ૭ માર્ચનાં રોજ વિવિધ કોલેજ તેમજ પોલિટેકનિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વકતૃત્વ, નિબંધ, ધીમી સાઇકલ ચલાવવી તથા ફૂલોના સુશોભન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિને, બંસીલાલ અમૃતલાલ કોલેજ નાં સભાખાંડમાં નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ ડો. સંજય અકબરી, મહિલા સેલ નાં ચેરમેન ડો. સુનિતા પિંટો તેમજ આમંત્રિત મહેમાનો ડો. અંકિતાબેન કિલ્લેદાર, ડો. ચેતનાબેન વ્યાસ, ગાયનેકોલોજિસ્ટ તથા શ્રીમતી શીતલબેન જોશી, મહિલા એડવોકેટની ઉપસ્થિતિમાં કાર્યક્રમ નું આયોજન થયું હતું જેમાં બહોળી સંખ્યામાં મહિલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અંદાજિત ૫૦૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ ડો. અકબરીસાહેબે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આમંત્રિત મહેમાન અને વકીલ શ્રીમતી શીતલબેન જોશીએ મહિલા ઉપયોગી કાયદાઓ તેમજ સમાજમાં જોવા મળતા મહિલાઓનાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી કઈ રીતે તે નિવારી શકાય તેનું સૌને માર્ગદર્શન આપ્યું હતું.. વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ ડો. ચેતનાબેન વ્યાસે મહિલાઓમાં પ્રજનન તંત્રને લગતી વિવિધ તકલીફો તેમજ તેના નિદાન માટેના ટેસ્ટ ઉપર વાત કરી ઉપસ્થિત સૌને ઉત્તમ માહિતી આપી હતી.

ડો. અંકિતાબેને તેઓના અભ્યાસ અને અનુભવોના આધારે ઉપસ્થિત મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને જીવનમાં આગળ વધવા અને કઈક કરી બતાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, આમંત્રિત મહેમાનોના હસ્તે વિવિધ સ્પર્ધાઓની વિજેતા વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણ થયું હતું. વકતૃત્વ સ્પર્ધાની વિજેતા વિદ્યાર્થીનીઓએ પોતાની આગવી છટાથી પોતાના વિચારો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા તેમજ સ્વસુરક્ષા ની તાલીમ લીધેલ વિદ્યાર્થીનીઓએ લીધેલ તાલીમ ઉપસ્થિત સૌને પ્રદર્શિત કરી હતી.

કાર્યક્રમ ને અંતે પ્રાધ્યાપક ડેરી ટેકનોલોજી તેમજ મહિલા સેલ નાં ચેરમેન ડો. સુનિતા પિંટોએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ ને અંતે મહિલા સેલનાં ચેરમેન ડો. સુનિતા પિંટોએ આભાર વિધિ કરી હતી. માન. કુલપતિશ્રી, આ.કૃ.યુ., આણંદે સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

